



ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરશા મુંડા ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

ટેલીફોન નં.૨૩૨૫૩૮૯૦, ૨૩૨૫૩૮૯૧, ૨૩૨૫૩૮૯૩

Email address:-dm.loan.gtdc@Gujarat.gov.in

વાહન માટે બેન્ક મારફત લીધેલ ધિરાણની સહાય વ્યાજ મેળવવાનું અરજી ફોર્મ રૂ.૫,૦૦,૦૦૦/- થી રૂ.૨૦,૦૦,૦૦૦/- સુધી.

અરજદાર નો
તાજેતરનો પ્રમાણિત
ફોટો (બેંક મેનેજર)

અરજદારનો ફોન નંબર:-

(અ) અરજદારની વિગત:-

(૧) અરજદારનું પૂરેપૂરું નામ:-

(૨) સરનામું:-મુ.....પો.....

તા.....જી.....પીન કોડ નં.....

(૩) અરજદારની ઉંમર :-

(જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સામેલ કરવું.)

(૪) અરજદારની જાતિ:-

(જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવું.)

(૫) આધાર કાર્ડ નંબર:-

(નકલ રજૂ કરવી)

(૬) બધા ધંધામાથી કુલ વાર્ષિક આવક:-

(સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજૂ કરવો)

(૭) અરજદારની શૈક્ષણિક લાયકાત:-

(૮) બેન્ક દ્વારા મેળવેલ લોન:- રૂ.....

બેન્કની શાખા/સરનામું:-

વાહનનો પ્રકાર:-

અરજદારના લાયસન્સ તથા બેઝની નકલ:-

મંજૂર થયેલ લોન:-

બેન્કના વ્યાજનો દર:-

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન મારફતે મળવાપાત્ર સબસીડી:-

(૯) બેંકમાથી લીધેલ લોનનો ખાતા નંબર તથા આઈએફસી કોડ કે જેમાં સહાય જમા કરવાની છે:-

અરજદારની સહી

.....

(૧૦) બેન્ક દ્વારા ભલામણ:-

શ્રીનેવાહન માટે
રૂ.....લોન તા. / /૨૦૨૦ ના રોજ આપવામાં આવેલ છે. જેના વ્યાજનો દર ,.....
છે. સદરહું લાભાર્થીને ૬% પ્રમાણે(વધુમાં વધુ રૂ.૧,૨૦,૦૦૦/-) ની વ્યાજ સહાય તેઓના
.....બેન્ક આઈએફસી કોડલોન ખાતા નંબરમાં જમા
કરવા આથી ભલામણ કરવામાં આવે છે.

સ્થળ:-

સહીતારીખ

સિક્કો

બ્રાન્ચ મેનેજરની

શરતો

- (૧) ગુજરાત રાજ્યના વતની હોય તેવા અનુચિત જનજાતિના ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અન્ય રાજ્યના અનુચિત જનજાતિના ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
- (૨) આ યોજનાનો લાભ ફક્ત અનુચિત જનજાતિના ઈસમોને આપવામાં આવશે. લાભાર્થીએ સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- (૩) બેંક દ્વારા રૂ.૫.૦૦ લાખ થી ૨૦ લાખ સુધીની મર્યાદામાં ફોરવીલરની મેળવેલ લોન સામે સહાય મેળવી શકાશે.
- (૪) બેંક દ્વારા મંજૂર થયેલ લોન ઉપર વાર્ષિક ૬% સુધી વ્યાજ સહાય ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર મારફત મળવાપાત્ર થશે. અને તે વધુમાં વધુ વાર્ષિક રૂ.૩૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધી વ્યાજ સહાય મળવાપાત્ર થશે. લોનની રકમના ૬% સુધી જ વ્યાજ મળવા પાત્ર થશે.
- (૫) અરજદારે બેંક માંથી લોન મેળવેલ છે તે મુજબનો પુરવો સહાય મેળવવા માટે રજૂ કરવાનો રહેશે,
- (૬) સહાય મેળવનાર અરજદારે ૫- વર્ષ સુધી વાહન વેચી નહી શકે,
- (૭) સહાયની રકમ લાભાર્થીના ખાતે RTGSથી જમા કરાવવામાં આવશે,
- (૮) અરજદારે આ યોજના હેઠળ લોન મેળવવા સંબંધિત બેંકને સીધી અરજી કરવાની રહેશે. બેંક દ્વારા લોન મંજૂર થાય ત્યારપછી અરજદારે તાત્કાલિક બેંક દ્વારા નિગમને જાણ કરવાની રહેશે. વ્યાજ સહાય ચુકવવા અંગેની ભલામણ નિગમને મળે તે પછી નિગમે જરૂરી ચકાસણી કરી વ્યાજ સહાય ચુકવવાની રહેશે. અરજદારને કોઈ પણ સંજોગોમાં લોનની રકમ રૂ.૨૦ લાખ ની વાહનની લોન મર્યાદામાં ફક્ત ૬% સુધી જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- (૯) અરજદાર તરફથી લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધારો રજૂ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- (૧૦) વ્યાજ સહાય મળવા અંગેની અરજીઓનો નમુનો પ્રાયોજના વહિવટદારઅથવા મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ ની કચેરીમાંથી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે.
- (૧૧) ઉપર જણાવેલ શરતો ઉપરાંત સરકારશ્રીને યોગ્ય લાગે તેવી અન્ય શરતો રાખી શકશે.
- (૧૨) બેંક દ્વારા મંજૂર થયેલ લોનના કાગળોની પ્રમાણિત નકલ તથા લોન ખાતાની પાસબુક/ આર સી બુકની નકલ સ્ટેટમેન્ટની નકલ રજૂ કરવાના રહેશે.